

No. of printed pages: 03

SARDAR PATEL UNIVERSITY
B. Com. (Ist Semester) Examination
20th Oct. 2016 (Thursday)
2.00 pm – 4.00 pm
UB01ECOM02/18 : Advanced Accounting - I

કુલ ગુણ : 50

નોંધ : જમણી બાજુના આંક પ્રશ્નના ગુણ દર્શાવે છે.

- પ્ર.૧ મિલિનકુમારની આછાંદમાં એક શાખા છે. શાખાને વેચાણ માટેનો તમામ માલ પડતર વત્તા ૨૦% ચઢાવીને ભરતિયા કિંમતે મુખ્ય ઓફિસેથી મોકલાય છે. શાખાને મળેલ રોકડ મુખ્ય ઓફિસના બેંકખાતામાં રોજબરોજ ભરવામાં આવે છે. નીચેની વિગતો પરથી મુખ્ય ઓફિસના ચોપડામાં તૈયાર કરો. (૧૫)

૧. શાખા ખાતુ ૩. શાખાનું પેટા રોકડ ખાતુ
૨. શાખાનું દેવાદારોનું ખાતુ ૪. શાખાનું વેપાર તથા નફા-નુકશાન ખાતુ

વિગત	૧-૧-૧૫ (રૂ.)	૩૧-૧૨-૧૫ (રૂ.)
સ્ટોક	૯૦૦૦	૭૨૦૦
દેવાદારો	૧૨૦૦૦	૧૩૫૦૦
પેટા રોકડ	૧૨૦	?
ફર્નિચર	૧૪૦૦૦	?

શાખાને મોકલેલ માલ	૨૭૯૦૦
મુખ્ય ઓફિસને પરત કરેલ માલ	૧૨૦૦
શાખાએ લખી વાળેલ ઘાલખાદ	૨૦૦
રોકડ વેચાણ	૨૦૦૦
ગ્રાહકોએ પરત કરેલ માલ	૩૦૦
શાખાના દેવાદારોને આપેલ વટાવ	૫૦૦
કુલ વેચાણ	૪૫૫૦૦
પરચુરણ ખર્ચા	૨૮૦
પરચુરણ ખર્ચ માટે શાખાને મોકલેલ રોકડ	૩૬૦

મુખ્ય ઓફિસથી ચૂકવેલ શાખાના ખર્ચા

ભાડુ + પેરા	૧૬૦૦
પગાર	૨૦૦૦
સ્ટાફ બોનસ	૬૦૦
જકાત	૫૦૦
	<u>૪૭૦૦</u>

ફર્નિચર પર ૧૦% ઘસારો ગણો.

અથવા

પ્ર.૧ ટ્રૂકનોંધ લખો : (૧૫)

- (૧) માર્ગસ્થ માલ અને માર્ગસ્થ રોકડ
- (૨) ભરતિયા કિંમત
- (૩) શાખાના દેવાદારોનું ખાતુ

પ્ર.૨ અશ્વિનકુમારે તા. ૧-૧-૯૫ના રોજ ટાટા મોટર્સ લિ. પાસેથી રૂ.૪૭૫૦૦ની મૂળકિંમતની મોટર ભાડા ખરીદ પદ્ધતિથી નીચેની શરતોએ ખરીદી : (૧૫)

- (૧) રૂ.૨૦૦૦૦ તા.૧-૧-૯૫ના રોજ ચૂકવી આપવા.
- (૨) રૂ.૧૦૦૦૦ તા.૩૧-૧૨-૯૫ના રોજ ચૂકવી આપવા.
- (૩) રૂ.૧૦૦૦૦ તા.૩૧-૧૨-૯૬ના રોજ ચૂકવી આપવા.
- (૪) રૂ.૧૦૩૦૯ તા.૩૧-૧૨-૯૭ના રોજ ચૂકવી આપવા.

વાર્ષિક બાકી પર ૫% વ્યાજ કંપની વસુલ કરે છે. દર વર્સે મૂળકિંમતના ૨૦% ઘસારો ગણાય છે.

ખરીદનાર (અશ્વિનકુમાર)ના ચોપડે આમનોંધ લખો.

અથવા

પ્ર.૨ (૧૫)

(૧) ભાડા ખરીદ પદ્ધતિ અને હપતા ખરીદ પદ્ધતિ વચ્ચેનો તફાવત.

(૨) ચંત્રની રોકડ કિંમત શોધો.

કરાર વખતે	૨૮૦૦૦	ત્રીજો વાર્ષિક હપતો	૧૮૮૦૦
પ્રથમ વાર્ષિક હપતો	૩૧૨૦૦	ચોથો વાર્ષિક હપતો	૧૩૨૦૦
બીજો વાર્ષિક હપતો	૨૪૮૦૦	વ્યાજનો દર વાર્ષિક	૧૦%

પ્ર.૩ તફાવત આપો : (૧૫)

(અ) શુદ્ધ એકનોંધી અને પ્રચલીત એકનોંધી

(બ) એકનોંધી હિસાબી પદ્ધતિ અને દ્વિનોંધી હિસાબી પદ્ધતિ

અથવા

પ્ર.૩ અજીતકુમાર કટલરીનો ઘંઘો કરે છે. નીચેની માહિતી પરથી તમને તા.૩૦-૬-૧૯૯૬ના રોજ પૂરા થતા વર્ષનો નફો કે નુકશાન શોધો. તથા તે તારીખનું સ્થિતિદર્શક પત્ર બનાવો. (૧૫)

વિગત	૧-૭-૯૫ (રૂ.)	૩૦-૬-૯૬ (રૂ.)
સ્ટોક	૧૬૭૦૦	૧૮૫૦૦
લેણદારો	૧૫૪૦૦	૧૪૦૦૦
દેવાદારો	૧૧૨૦૦	૧૦૫૦૦
રોકડ	૨૫૦	૧૨૦૦
બેંક ઓવરડ્રાફ્ટ	૨૦૨૦૦	૧૯૪૦૦
લેણી હૂંડી	૧૫૦૦૦	૧૪૨૦૦
ફર્નિચર	૧૫૦૦	૨૫૦૦
મોટર	૧૯૦૦	૧૯૦૦

વર્ષ દરમિયાન ઉપાડ રૂ.૧૧૦૦ થયો હતો. રૂ.૫૦૦ તેમની જીંદગીના વિમા પ્રિમિયમ ભર્યું. તેમજ રૂ.૧૦૦૦ ઇન્કમેટેક્સ ભર્યો હતો. ફર્નિચર પર ૧૦% ઘસારો કાપો. મોટરમાંથી રૂ.૩૦૦ માંડી વાળો. દેવાદારોમાંથી રૂ.૫૦૦ ફૂલેલા છે. દેવાદારો પર ૫% ઘા.અનામત રાખો. લેણીહૂંડી પર રૂ.૭૦૦ અનામતની જોગવાઈ કરો. તેઓ રૂ.૧૦૦૦નું અંગત ફર્નિચર વર્ષ દરમિયાન ઇંધામાં લાવ્યા.

પ્ર.૪ ટૂંકનોંધ લખો :

(૧૫)

(અ) વેચાણ આંકડો

(બ) આડત અને આસામી આડત

(ક) આડતમાલ અને વેચાણ

અથવા

પ્ર.૪ અમદાવાદના અનુપમ ફર્નિચર માટે મુંબઈના પવાર બ્રધર્સ પર રૂ.૪૦૦૦નું એક એવા ૪૦ સ્ટીલના કબાટ આડતથી વેચવા મોકલ્યા. આડતમાલ વેચાણની શરત મુજબ આડતીયાને વેચાણ પર ૫% કમીશન આપવાનું હતું. તેમણે અનુપમ ફર્નિચર માટેની લખેલી રૂ.૮૦૦૦૦ની ત્રણ માસની હૂંડી આડતમાલના એડવાન્સ તરીકે સ્વીકારી માલઘણીએ આ હૂંડી વાર્ષિક ૧૨%ના દરે વટાવી.

(૧૫)

કબાટ મોકલતા તેમણે રૂ.૭૦૦૦ રેલ્વે નૂર અને મજૂરીના ૪૦૦૦ ચૂકવ્યા. પવાર બ્રધર્સે માલ છોડાવ્યો. મજૂરી જકાતના રૂ.૧૦૦૦૦ ચૂકવ્યા. બે માસ પછી મોકલેલ વેચાણ આંકડામાં તેમણે જણાવ્યું કે ૩૫ કબાટ રૂ.૬૦૦૦ લેખે વેચાયા હતા. એક માસ પછી મોકલેલ બીજા વેચાણ આંકડા મુજબ બાકીના પાંચ કબાટ રૂ.૫૫૦૦ લેખે વેચાયા હતા. પવાર બ્રધર્સે પોતાનું કમીશન કાપી બાકી રકમનો ડ્રાફ્ટ મોકલી હિસાબ ચૂકવે કરવો.

અનુપમ ફર્નિચર માર્ટના ચોપડે :

(૧) આડતમાલ ખાતુ

(૨) આડતીયાનું ખાતુ

(૩) આડતથી મોકલેલ માલ ખાતુ ; તૈયાર કરો.

* * * *

